

17th August, 2021

To,
Listing Department,
National Stock Exchange of India Ltd.,
Exchange Plaza, C-1, Block G,
BandraKurla Complex,
Bandra (E), Mumbai – 400 051

Sub.: Newspaper Publication of Un-Audited Financial Results under Regulation 47 of the SEBI LODR Regulations, 2015 for Quarter ended on 30th June, 2021

Ref:Shree Ram Proteins Limited (Symbol:-SRPL, ISIN:- INE008Z01012)

Dear Sir/Madam,

With respect to the captioned subject, Please find attached herewith copies of newspapers advertisements of Un-audited financial results for the quarter ended on 30th June, 2021, which was published in "Financial Express", English Edition and "Financial express" Gujarati Edition on 14th August, 2021.

We request you take it in your record.

Thanking you,

Yours faithfully,
For and on behalf of

Shree Ram Proteins Limited



BhupendraKanjibhaiBhadani
Company Secretary and Compliance Officer
Membership No:A20470

Encl:- A/a

MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LIMITED
(FOR IMMOVABLE PROPERTY) Rule 3(1) of Securities Interest (Enforcement Rules 2002)

Whereas the undersigned being the authorized officer of the MAS Rural Housing & Mortgage Finance Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act - 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 29/11/2019 calling upon the Borrower/Co-borrower/Guarantor to repay the amount mentioned in the notice being within Sixty Days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower/Co-borrower/Guarantor and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the said [Act] read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002, on this 10th day of August of the year 2021. The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the Property will be subject to the charge of the **MAS Rural Housing & Mortgage Finance Ltd.** as on **Date 29/11/2019**, and interest thereon.

The Borrower attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

| Borrower & Co-Borrower, Guarantor Name | Description Of The Immovable Property | Loan A/C No Date of Possession | Date & Amount of Demand Notice |
|--|--|--------------------------------------|---|
| (1) Mr. Kanubhai Muljibhai Patel (Applicant) (2) Ms. Shardaben Kanubhai Patel (Co-Applicant) (3) Mr. Sachinbhai Lavjibhai Patel (Guarantor) | ALL THAT PIECE & PARCEL OF Property No. 28 (20X68.6) Adm. 127.46 Sq. Mts., and construction thereon situated at Village: Tintisar, P.O. Sardoi (Sajapur Group Gram Panchayat), Tal. Modasa, District and Registration Sub-District Arvali, Gujarat | Loan Account No : 1208 10-08-2021 | Rs. 4,77,458/- in Words (Rupees Four Lakh Seventy Seven Thousand Four Hundred Fifty Eight only) Dt. 29-11-2019 |
| (1) Shaileshsinh Parbatsinh Makwana (Applicant) (2) Parbatsinh Hirsinh Makwana (Co-Applicant) and (3) Sursingh Vajeseenh Makwana (Guarantor) | ALL THAT PIECE & PARCEL OF Property 333 Adm. 65.05 Sq. Mts., and construction thereon situated at Gamtal Village: Lalpur (Kidi Group Gram Panchayat), Tal. Dhansura, District and Registration Sub-District Arvali, Gujarat | Loan Account No : 1474 10-08-2021 | Rs. 5,32,219/- in Words (Rupees Five Lakh Thirty Two Thousand Two Hundred Nineteen only) Dt. 29-11-2019 |

Date : 14-08-2021
Place : Arvali

Authorized Signatory, Mr. Bharat J. Bhatt (M.) 9714199018
For, MAS Rural Housing & Mortgage Finance Ltd.

Chartered Capital And Investment Limited
Regd Office: 711, Mahakant, Opp. V 5 Hospital, Ellisbridge, Ahmedabad-380006
(CIN: L45201GJ1986PLC008577) Phone: +91-79-2657 5337, Fax: +91-79-2657 5337
Email: info@charteredcapital.net, Website: www.charteredcapital.net

Extract of Un-audited Financial Results for the Quarter ended June 30, 2021

| Sr. No. | Particulars | Quarter Ended | | | Year ended |
|---------|--|---------------|------------|------------|------------|
| | | 30.06.2021 | 30.06.2020 | 31.03.2021 | |
| 1 | Total Income from operations (excluding other income) | 20.26 | 21.22 | 141.02 | |
| 2 | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) | 6.16 | 8.94 | 52.20 | |
| 3 | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) | 6.16 | 8.94 | 52.20 | |
| 4 | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) | 3.48 | 12.59 | 45.06 | |
| 5 | Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)) | 709.01 | 791.44 | 1958.84 | |
| 6 | Equity Share Capital | 303.16 | 303.16 | 303.16 | |
| 7 | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year | - | - | 4935.45 | |
| 8 | Earnings Per Share (Face Value Rs. 10/- each) | 0.12 | 0.42 | 1.50 | |
| | - Basic | 0.12 | 0.42 | 1.50 | |
| | - Diluted | 0.12 | 0.42 | 1.50 | |

The above is an extract of the detailed Unaudited Financial Results for quarter ended June 30, 2021 filed with the SEBI under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirement) Regulation, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange website: www.bseindia.com and also on the Company's website: www.charteredcapital.net.

Place: Ahmedabad
Date: August 13, 2021

For, Chartered Capital And Investment Limited
Molih N Khericha, Managing Director

Shivalik Bimetal Controls Ltd.
Regd office: 16-18, New Electronics Complex, Chamba Nagar Dist. Solan HP 173213
Head Office: H-2, Sunjea Chambers, Ind Floor, Alaknanda Commercial Complex, New Delhi-110019, Ph: +91-011-26027174, 26026302, Fax: +91-011-26026776
Website: www.shivalikbimetals.com, Email: investor@shivalikbimetals.com
CIN : L2710HP1984PLC005862

NOTICE

In view of the continuing Covid-19 Pandemic, the Ministry of Corporate Affairs (MCA) has vide its circular dated May 5, 2020 read with circulars dated April 8, 2020, April 13, 2020 and January 13, 2021, permitted the holding of Annual General Meeting (AGM) through Video Conference or Other Audio-Visual Means (OAVM). In compliance with these Circulars and the relevant provisions of the Companies Act, 2013 and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the upcoming AGM of the Company will be held on Wednesday, the 15th day of September, 2021 at 10.30 AM through VC/OAVM.

As per aforesaid circulars, the Notice of AGM along with the Annual Report for FY 2020-21 has to be sent only by electronic mode to those Members whose E-mail ID are already registered with the Company/ Depositories. The Company is also providing e-voting and remote e-voting facility to all its Members similar to earlier practices.

If your email ID is already registered with the Company/ Depository, Notice of AGM along with Annual Report for FY 2020-21 and login details for e-voting shall be sent to your registered email address. In case you have not registered your email ID with the Company/ Depository, please follow below instructions to register your email ID for obtaining Annual Report for FY 2020-21 and login details for e-voting.

Physical Holding
Send a request to Registrar and Transfer Agents of the Company, MAS Services Limited at info@maserv.com providing Folio number, Name of the shareholder, scanned copy of the share certificate (Front and Back), PAN/Self attested scanned copy of PAN Card, AADHAR (Self attested scanned copy of Aadhar Card) for registering email address.
Please send your bank detail with original cancelled cheque to our RTA (i.e. MAS Services Limited, T-34 2nd Floor, Okhla Industrial area Phase-II, New Delhi 110020 alongwith letter mentioning folio no. if not registered already.)
PLEASE UPDATE THE SAME ON OR BEFORE 08TH SEPTEMBER, 2021

Demat Holding
Please contact your Depository Participant (DP) and register your email address as per the process advised by DP.
Please also update your bank detail with your DP for dividend payment by NACH if declare by company.
PLEASE UPDATE THE SAME ON OR BEFORE 08TH SEPTEMBER, 2021

The Notice of AGM and Annual Report for FY 2020-21 will also be available on Company's website - www.shivalikbimetals.com, website of BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com. Members attending the meeting through VC/ OAVM shall be counted for the purpose of Quorum under Section 103 of the Companies Act, 2013. For Shivalik Bimetal Controls Limited

Sd/-
Aarti Sahni
Company Secretary

Place: New Delhi
Date: 13.08.2021

SHREE RAM PROTEINS LIMITED
CIN:L01405GJ2008PLC054913
Registered Office: Imperial Heights Tower-B, Second Floor, Office No. B-206, 150 Ft Ring Road, Opp Big Bazar Rajkot -360005, Phone: +91 2825280634/35
Fax: +91 7878036500 • Email: info@shreeramproteins.com • Website: www.shreeramproteins.com

Standalone Unaudited Financial Results for the Quarter ended on June 30, 2021

(Rs. in Lakh except EPS)

| Sl. No. | Particulars | Quarter ended | | Year ended |
|---------|--|---------------|------------|------------|
| | | 30-06-2021 | 30-06-2020 | |
| | | Unaudited | Unaudited | Audited |
| 1. | Total Income From Operations (net) | 3,890.04 | 347.21 | 15,268.07 |
| 2. | Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items#) | 135.86 | (19.41) | 109.69 |
| 3. | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#) | 135.86 | (19.41) | 109.69 |
| 4. | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#) | 101.65 | (19.41) | 83.67 |
| 5. | Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)) | 101.65 | (19.41) | 84.45 |
| 6. | Equity Share Capital (Face value of Rs. 10 Each) | 2,142.00 | 2,142.00 | 2,142.00 |
| 7. | Reserves (excluding Revaluation Reserve as shown in the audited Balance Sheet of the previous year) | - | - | - |
| 8. | Earnings Per Share (of Rs. 10/- each) for (continuing and discontinued operations) (not annualized for quarter ended) | 0.47 | (0.09) | 0.39 |
| | Basic : (not annualized for the quarter ended) | 0.47 | (0.09) | 0.39 |
| | Diluted: (not annualized for the quarter ended) | 0.47 | (0.09) | 0.39 |

Note:- The above results were reviewed by the Audit committee and subsequently taken on record by the Board of Directors of the company at its meeting held on August 13, 2021. The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the NSE Ltd.. The full format of the quarterly Financial Results are available on the NSE Ltd Website at www.nseindia.com and on the website of the Company at www.shreeramproteins.com

For, SHREE RAM PROTEINS LIMITED
Sd/-
LALTIKUMAR CHANDULAL VASOYA
Managing Director DIN: 02296254

Place: Rajkot
Date : August 13, 2021

DCM LIMITED
Regd. Office: Unit Nos. 2050-2052, 2nd Floor, Plaza-II, Central Square, 20, Manohar Lala Khurana Marg, Bara Hindu Rao, Delhi - 110 006
E-mail: investors@dcm.in Phone: 011-41539170 CIN: L74899DL1889PLC000004

EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2021 [IN TERMS OF REGULATION 47 (1) (B) OF THE SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATION, 2015]

(Rs in Lakh)

| Sr. No. | Particulars | Standalone | | | | Consolidated | | | |
|---------|--|-------------------------|------------------------|-------------------------|------------------------|-------------------------|------------------------|-------------------------|------------------------|
| | | For the quarter ended | | For the year ended | | For the quarter ended | | For the year ended | |
| | | June 30, 2021 Unaudited | March 31, 2021 Audited | June 30, 2020 Unaudited | March 31, 2021 Audited | June 30, 2021 Unaudited | March 31, 2021 Audited | June 30, 2020 Unaudited | March 31, 2021 Audited |
| 1 | Total income from operations | 7 | 24 | (28) | 50 | 1589 | 1381 | 1118 | 4740 |
| 2 | Net Profit/(Loss) for the period (before tax) | 810 | (316) | (596) | (1997) | 1139 | 14 | (604) | (1741) |
| 3 | Net Profit/(Loss) for the period after tax | 810 | (316) | (596) | (1,997) | 1087 | 33 | (630) | (1784) |
| 4 | Total Comprehensive Income/(Expense) for the period [Comprising Profit/(Loss) for the period after tax and Other Comprehensive Income/(Expense)] | 826 | (225) | (596) | (1933) | 1103 | 143 | (630) | (1712) |
| 5 | Equity Share Capital | 1868 | 1868 | 1868 | 1868 | 1868 | 1868 | 1868 | 1868 |
| 6 | Other equity | - | - | - | (2380) | - | - | - | (3774) |
| 7 | Earnings/ (loss) per equity share (EPS) of Rs. 10 each (not annualised) | 4.34 | (1.69) | (3.19) | (10.69) | 5.81 | 0.18 | (3.37) | (9.55) |
| | Basic and diluted | | | | | | | | |

Notes:

- The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meeting(s) held on August 13, 2021. The Limited Review Report of the Statutory Auditors has been filed with the BSE Limited and National Stock Exchange of India Limited.
- The above is an extract of the detailed format of financial results filed with the Stock Exchanges (i.e. BSE Limited and National Stock Exchange of India Limited) under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The details in prescribed format of the results are available on the website of Stock Exchanges (www.bseindia.com and www.nseindia.com) and the Company's website www.dcm.in.

For and on behalf of the Board of Directors
Sd/-
Jitendra Tuli
Managing Director
DIN: 00272930

Place: Delhi
Date: 13 August, 2021

Ahmedabad

SAL AUTOMOTIVE LIMITED
(formerly Swaraj Automotives Limited)
CIN : L45202PB1974PLC003516
Regd. Office : C -127, IV Floor, Satguru Infotech, Phase VIII, Industrial Area, S.A.S.Nagar (Mohali), Punjab - 160062
Tel. : 0172-4650377, Fax : 0172-4650377,
Email : kaushik.gagan@salautomotive.in, Website : www.salautomotive.in

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30th JUNE, 2021

| Sl. No. | Particulars | Quarter Ended | | | Year Ended |
|---------|---|---------------|-----------|-------------|------------|
| | | 30.06.21 | 31.03.21 | 30.06.20 | |
| | | (Unaudited) | (Audited) | (Unaudited) | (Audited) |
| 1 | Total Income | 3174 | 3192 | 918 | 9595 |
| 2 | EBITDA | 94 | 129 | (119) | 291 |
| 3 | Net Profit / (Loss) before tax and exceptional items | 25 | 73 | (166) | 85 |
| 4 | Net Profit / (Loss) before tax and after exceptional items | 25 | 73 | (166) | 85 |
| 5 | Tax Expense | 3 | 14 | (41) | 1 |
| 6 | Net Profit / (Loss) after tax and exceptional items | 22 | 59 | (125) | 84 |
| 7 | Total Comprehensive Income for the period (comprising profit / (loss) after tax and other comprehensive income after tax) | 22 | 72 | (125) | 97 |
| 8 | Paid-up Equity Share Capital (Face Value Rs. 10/-) | 240 | 240 | 240 | 240 |
| 9 | Reserves (excluding Revaluation Reserve) | - | - | - | 3116 |
| 10 | Earning Per Share on net profit after tax (Not Annualised) | | | | |
| | - Basic | 0.94 | 3.02 | (5.20) | 4.05 |
| | - Diluted | 0.94 | 3.02 | (5.20) | 4.05 |

Notes:

- The above financial results were reviewed by the audit committee and thereafter approved by the Board of Directors in their meeting held at Ghaziabad on dated 13.08.2021. The Statutory Auditors have conducted a limited review of the above financial results.
- These financial results have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Ind AS 34 "Interim Financial Reporting" prescribed under Section 133 of the Companies Act, 2013 read with the relevant rules issued thereunder and other accounting principles relevant thereto.
- The figures for the previous quarter ended 31st March, 2021 are the balancing figure between the audited figures in respect of full financial year ended on 31st March, 2021 and published unaudited year to date figures up to the nine months of the financial year 2020-21.
- Pursuant to Rule 29 of Companies (Incorporation) Rules 2014, under Section 13 of The Companies Act, 2013, company name has been changed from Swaraj Automotives Limited to SAL Automotive Limited on 4th June, 2019.
- Previous year figures have been regrouped / recasted / reclassified in line with Ind AS , wherever necessary to make them comparable.

For and on behalf of Board of Directors
Place : Ghaziabad
Date : 13th Aug'2021

Rama Kant Sharma
(Managing Director)

www.salautomotive.in

SHALIMAR PAINTS LIMITED
CIN : L24222HR1902PLC065611
Regd. Office: Stainless Centre, 4th Floor, Plot No. 50, Sector 32 Gurugram -122001, Haryana
Website: www.shalimarpaints.com
Email: askus@shalimarpaints.com, Ph No. : +91 124 4616600

REGULATION 47 (1)(b) OF SEBI (LODR) REGULATIONS, 2015 EXTRACTS OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2021

(Rs in Crore except for Shares and EPS)

| Sl. No. | Particulars | Quarter Ended | | Year Ended | |
|---------|---|---------------|------------|-------------|------------|
| | | 30.06.2021 | 31.03.2021 | | 30.06.2020 |
| | | (Unaudited) | (Audited) | (Unaudited) | (Audited) |
| 1 | Total Income from Operations | 65.17 | 111.74 | 44.48 | 325.56 |
| 2 | EBITDA# | (8.86) | 5.32 | (5.23) | 10.57 |
| 3 | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) | (16.96) | (3.18) | (12.85) | (21.79) |
| 4 | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) | (19.44) | (3.18) | (14.85) | (23.79) |
| 5 | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) | (19.44) | (28.56) | (10.61) | (49.87) |
| 6 | Total Comprehensive Income for the period (Comprising Profits / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)) | (19.46) | (28.58) | (10.60) | (49.73) |
| 7 | Paid up Equity Share Capital (Face Value of Rs. 2/- each) | 10.86 | 10.86 | 10.86 | 10.86 |
| 8 | Other Equity | - | - | - | 212.21 |
| 9 | Earnings Per Share (Face Value of Rs. 2/- each) for (continuing and discontinued operations)- | | | | |
| | Basic | (3.58) | (5.26) | (1.95) | (9.18) |
| | Diluted* | (3.58) | (5.26) | (1.95) | (9.18) |

Unaudited Standalone Financial Information

| Sl. No. | Particulars | Quarter Ended | | Year Ended | |
|---------|--|---------------|------------|-------------|------------|
| | | 30.06.2021 | 31.03.2021 | | 30.06.2020 |
| | | (Unaudited) | (Audited) | (Unaudited) | (Audited) |
| 1 | Total Income from Operations | 65.17 | 111.74 | 44.48 | 325.56 |
| 2 | EBITDA# | (8.77) | 5.43 | (5.15) | 10.91 |
| 3 | Net Profit for the period before tax** | (19.34) | (3.07) | (14.77) | (23.43) |
| 4 | Net Profit for the period after tax | (19.34) | (28.45) | (10.53) | (49.51) |

* Anti-dilutive

#EBITDA= Earning before Interest, Tax and Depreciation & Amortization (before exceptional items)

- The above is an extract of the detailed format of Quarterly Financial Results for the quarter ended June 30, 2021, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results for the quarter ended June 30, 2021, is available on the website of Stock Exchanges at (www.bseindia.com / www.nseindia.com) as well as on the Company's Website at (www.shalimarpaints.com).
- On 4th Jan 2019, the company had allotted 3,11,43,042 equity shares of face value Rs. 2 each at the price of Rs. 64.50 per share (including premium of Rs. 62.50 per share) aggregating to Rs. 200.87 Crore to the eligible equity shareholders on Rights basis in the ratio of 3 equity shares for every 2 equity shares held.

Proceeds from the Right Issue have been utilised in the following manner (Rs. in crores)

| Particulars | Proposed to be utilised as per Letter of offer | Proposed to be utilised (revised)* | Utilised till March 2021 | Utilised during the financial year 2021-22 | To be utilised |
|---|--|------------------------------------|--------------------------|--|----------------|
| Project of reinstatement of paint manufacturing plant at Nashik | 45.68 | 44.92 | 42.96 | 0.20 | 1.76 |
| Setting up of Regional Distribution Centre (RDC) at Nashik | 3.40 | 0.40 | 0.40 | - | - |
| Long Term Working Capital Requirements | 117.38 | 121.14 | 121.14 | - | - |
| General Corporate purposes | 34.15 | 34.15 | 34.15 | - | - |
| Expenses for Rights Issue | 0.26 | 0.26 | 0.26 | - | - |
| Total | 200.87 | 200.87 | 198.91 | 0.20 | 1.76 |

*There is increase in the allocation of funds towards Long Term Working Capital Requirement, and the same has been allocated through reduction in Nashik project (including RDC) cost.

- These Consolidated Unaudited Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on Aug 13, 2021. Limited Review of these results are in accordance with Regulation 33 of SEBI (LODR) Regulations, 2015 has been carried out by the Statutory Auditors.

For and on behalf of the Board
Ashok Kumar Gupta
Managing Director
DIN: 01722395

Place: Gurugram
Date: Aug 13, 2021

www.financialexp.epapr.in

Bank of Baroda
વૈક ઓફ બરોડા
ASTODI@bankofbaroda.com

આસ્ટોડીયા શાખા:
 ધામની પોળની સામે, આસ્ટોડીયા, અમદાવાદ-૧,
 ફોન: ૦૭૯ ૨૬૩૨૩૨૨૨
 E-mail: ASTODI@bankofbaroda.com

પરોશન નોટિસ
 (એનસ્ટર-૩) (ફક્ત સ્થાયર મિલકત અંગે)

આથી, બેંક ઓફ બરોડાના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ ધ સિક્યોરીટીઝ ડેવલપમેન્ટ એન્ડ રિફરન્સિંગ ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ (સેક્ટ-૨) એક્ટ, ૨૦૦૨ તથા કલમ ૧૩(૨) હેઠળ મળેલ સત્તા સાથે સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ સાથે વંચાતા નિયમ ૩ અંતર્ગત તારીખ ૧૦-૦૫-૨૦૨૧ ના રોજ ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવેલ હતી તે અનુસાર અહાલકર્તા ઈમિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નોટિસમાં જણાવ્યા મુજબ બેંકની લેણી રકમ રૂ. ૩૩,૨૩,૪૬૬.૬૬ (રૂપિયા ત્રણ લાખ ત્રેવીસ હજાર ચારસો નવપચાસ પુરા) આ નોટિસ મળ્યાથી ૧૦ દિવસની અંદર પરત ચૂકવવા માટે નોટિસ આપેલ હતી.

ઉપરોક્ત કમ્પાક્ટ બેંકની લેણી રકમ પરત કરવામાં નિષ્ફળ જવાથી, ખાસ કમ્પાક્ટને અને જાહેર જનતાને આથી નોટિસ આપવામાં આવે છે કે નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ નીચે જણાવેલ મિલકતને તેમને સહર કમ્પાક્ટની કલમ ૧૩(૪) સાથે જણાવેલ નિયમો સાથે વંચાતા નિયમ નં. ૮ હેઠળ મળેલ સત્તાની રૂબરૂ તા. ૧૦-૦૮-૨૦૨૧ના રોજ કબજો મેળવી લીધેલ છે.

કમ્પાક્ટ/જામીનદાર/મોર્ગેજરને ખાસ અને જાહેર જનતાને સામાન્યતઃ ચેતવણી આપવામાં આવે છે કે નીચે જણાવેલ મિલકતો સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અથવા કોઈપણ પ્રકારનો વ્યવહાર તે મિલકત અંગેનો બેંક ઓફ બરોડાના લેણાં નીકળતા નાણાં રૂ. ૩૩,૨૩,૪૬૬.૬૬ (રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર ચારસો નવપચાસ પુરા) તેની ઉપર કોન્ટ્રોલિંગ અધિકાર રેટ મુજબ ચડતું વ્યાજ, ક્રેડિટ, ચાર્જિસ પેમેન્ટ આપે તે તારીખ સુધીના ખર્ચા વગેરેના બોજાને આપિત રહેશે.

"કમ્પાક્ટને સરકારી એક્ટની સંકલન ૧૩ની પેટા કલમ (૮)ની જગ્યાએ અનુસાર સુરક્ષિત મિલકતોને બચાવવા માટે પ્રાપ્ય થતા લાભ અને ધ્યાન ધોરણમાં આવે છે."

સ્થાયર મિલકતનું વર્ણન

મિલકતનો તમામ ભાગ અને કિસ્સો - ફ્લેટ નં. ૮, નેમિનાથ એપાર્ટમેન્ટ, સમર્પક હોલ, કંકરિયા કુટબોલ ગ્રાઉન્ડ પાછળ, કંકરિયા, રજી સબ ડિ. અમદાવાદ અને ડિ. અમદાવાદ માં આવેલ છે, કે જેની ચતુ:સીમા નીચે મુજબ છે:

ઉત્તર: ખુલ્લું આકાશ, દક્ષિણ: પેલેસ અને પછી ફ્લેટ નં. ૧૦, પૂર્વ: બીજી સોસાયટી, પશ્ચિમ: ફ્લેટ નં. ૮ અને ખુલ્લી જગ્યા.

તા: ૧૦-૦૮-૨૦૨૧
 સ્થળ: અમદાવાદ

અધિકૃત અધિકારી
 ઠેક ઓફ ઇન્ડોર

Bank of Baroda
વૈક ઓફ બરોડા
ASTODI@bankofbaroda.com

આંધીરોડ શાખા:
 પો.ઓ. બોક્સ નં. ૧૦૧, કુવારા, આંધી રોડ,
 અમદાવાદ-૩૮૦૦૦૧
 ફોન. ૦૭૯ ૨૬૩૨૩૨૨૨
 E-mail: ganahm@bankofbaroda.com

પરોશન નોટિસ
 (એનસ્ટર-૩) (ફક્ત સ્થાયર મિલકત અંગે)

આથી, બેંક ઓફ બરોડાના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ ધ સિક્યોરીટીઝ ડેવલપમેન્ટ એન્ડ રિફરન્સિંગ ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ (સેક્ટ-૨) એક્ટ, ૨૦૦૨ તથા કલમ ૧૩(૨) હેઠળ મળેલ સત્તા સાથે સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ સાથે વંચાતા નિયમ ૩ અંતર્ગત તારીખ ૦૫-૦૫-૨૦૨૧ ના રોજ ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવેલ હતી તે અનુસાર અહાલકર્તા મે. સ્મૃતિ કિરોશન, શ્રીમતિ કિરોશન હરમુખ જોશી અને જામીનદાર શ્રી મહાદેવ દીલાલ વાલ્મી અને શ્રી હરમુખ ડાનવીલાલ જોશીની મિલકત સંબંધી નોટિસમાં જણાવ્યા મુજબ બેંકની લેણી રકમ રૂ. ૧૨,૨૬,૬૫૩.૦૩ (રૂપિયા બાર લાખ છ વચ્ચીસ હજાર નવસો તેવન અને પેસા ત્રણ પુરા) આ નોટિસ મળ્યાથી ૧૦ દિવસની અંદર પરત ચૂકવવા માટે નોટિસ આપેલ હતી.

ઉપરોક્ત કમ્પાક્ટ બેંકની લેણી રકમ પરત કરવામાં નિષ્ફળ જવાથી, ખાસ કમ્પાક્ટને અને જાહેર જનતાને આથી નોટિસ આપવામાં આવે છે કે નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ નીચે જણાવેલ મિલકતને તેમને સહર કમ્પાક્ટની કલમ ૧૩(૪) સાથે જણાવેલ નિયમો સાથે વંચાતા નિયમ નં. ૮ હેઠળ મળેલ સત્તાની રૂબરૂ તા. ૧૦-૦૮-૨૦૨૧ના રોજ કબજો મેળવી લીધેલ છે.

કમ્પાક્ટ/જામીનદાર/મોર્ગેજરને ખાસ અને જાહેર જનતાને સામાન્યતઃ ચેતવણી આપવામાં આવે છે કે નીચે જણાવેલ મિલકતો સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અથવા કોઈપણ પ્રકારનો વ્યવહાર તે મિલકત અંગેનો બેંક ઓફ બરોડાના લેણાં નીકળતા નાણાં રૂ. ૧૨,૨૬,૬૫૩.૦૩ (રૂપિયા બાર લાખ છ વચ્ચીસ હજાર નવસો તેવન અને પેસા ત્રણ પુરા) તેની ઉપર કોન્ટ્રોલિંગ અધિકાર રેટ મુજબ ચડતું વ્યાજ, ક્રેડિટ, ચાર્જિસ પેમેન્ટ આપે તે તારીખ સુધીના ખર્ચા વગેરેના બોજાને આપિત રહેશે.

"કમ્પાક્ટને સરકારી એક્ટની સંકલન ૧૩ની પેટા કલમ (૮)ની જગ્યાએ અનુસાર સુરક્ષિત મિલકતોને બચાવવા માટે પ્રાપ્ય થતા લાભ અને ધ્યાન ધોરણમાં આવે છે."

સ્થાયર મિલકતનું વર્ણન

મિલકતનો તમામ ભાગ અને કિસ્સો - ફ્લેટ નં. બી-૧૩, સેક્ટર ૧૮૦.૦૦ ચો.ટીટ, ન્યુ વિજય કો. ઓપ. હાઉસિંગ સોસાયટી લીમિટેડના વિહાર કોમ્પ્લેક્સ ઓનર્સ એસોસિએશનના વિજય પ્લાઝામાં, લેન્ડ રેવન્યુ ટી પી સ્કીમ નં. ૨, એ. પી. નં. ૧૨, ગામ રાજપુર-કીરપુર, ડિ. અમદાવાદમાં આવેલ છે, કે જેની ચતુ:સીમા નીચે મુજબ છે:

ઉત્તર: પાકિ, દક્ષિણ: ફ્લેટ નં. બી-૭, પૂર્વ: ફ્લેટ નં. બી-૧૨, પશ્ચિમ: ફ્લેટ નં. બી-૧૪.

તા: ૧૦-૦૮-૨૦૨૧
 સ્થળ: અમદાવાદ

અધિકૃત અધિકારી
 ઠેક ઓફ ઇન્ડોર

Bank of Baroda
વૈક ઓફ બરોડા
ASTODI@bankofbaroda.com

આંધીરોડ શાખા:
 પો.ઓ. બોક્સ નં. ૧૦૧, કુવારા, આંધી રોડ,
 અમદાવાદ-૩૮૦૦૦૧
 ફોન. ૦૭૯ ૨૬૩૨૩૨૨૨
 E-mail: ganahm@bankofbaroda.com

પરોશન નોટિસ
 (એનસ્ટર-૩) (ફક્ત સ્થાયર મિલકત અંગે)

આથી, બેંક ઓફ બરોડાના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ ધ સિક્યોરીટીઝ ડેવલપમેન્ટ એન્ડ રિફરન્સિંગ ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ (સેક્ટ-૨) એક્ટ, ૨૦૦૨ તથા કલમ ૧૩(૨) હેઠળ મળેલ સત્તા સાથે સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ સાથે વંચાતા નિયમ ૩ અંતર્ગત તારીખ ૦૫-૦૫-૨૦૨૧ ના રોજ ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવેલ હતી તે અનુસાર અહાલકર્તા શ્રી જગદીશ દીલાલ વાલ્મી, શ્રીમતિ મહુબેન જગદીશ વાલ્મી, શ્રી પરેશ જગદીશભાઈ વાલ્મી અને શ્રી કલ્પેશ જગદીશભાઈ વાલ્મી નોટિસમાં જણાવ્યા મુજબ બેંકની લેણી રકમ રૂ. ૩૩,૨૩,૪૬૬.૬૬ (રૂપિયા ત્રણ લાખ ત્રેવીસ હજાર ચારસો નવપચાસ પુરા) આ નોટિસ મળ્યાથી ૧૦ દિવસની અંદર પરત ચૂકવવા માટે નોટિસ આપેલ હતી.

ઉપરોક્ત કમ્પાક્ટ બેંકની લેણી રકમ પરત કરવામાં નિષ્ફળ જવાથી, ખાસ કમ્પાક્ટને અને જાહેર જનતાને આથી નોટિસ આપવામાં આવે છે કે નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ નીચે જણાવેલ મિલકતને તેમને સહર કમ્પાક્ટની કલમ ૧૩(૪) સાથે જણાવેલ નિયમો સાથે વંચાતા નિયમ નં. ૮ હેઠળ મળેલ સત્તાની રૂબરૂ તા. ૧૦-૦૮-૨૦૨૧ના રોજ કબજો મેળવી લીધેલ છે.

કમ્પાક્ટ/જામીનદાર/મોર્ગેજરને ખાસ અને જાહેર જનતાને સામાન્યતઃ ચેતવણી આપવામાં આવે છે કે નીચે જણાવેલ મિલકતો સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અથવા કોઈપણ પ્રકારનો વ્યવહાર તે મિલકત અંગેનો બેંક ઓફ બરોડાના લેણાં નીકળતા નાણાં રૂ. ૩૩,૨૩,૪૬૬.૬૬ (રૂપિયા ત્રણ લાખ ત્રેવીસ હજાર ચારસો નવપચાસ પુરા) તેની ઉપર કોન્ટ્રોલિંગ અધિકાર રેટ મુજબ ચડતું વ્યાજ, ક્રેડિટ, ચાર્જિસ પેમેન્ટ આપે તે તારીખ સુધીના ખર્ચા વગેરેના બોજાને આપિત રહેશે.

"કમ્પાક્ટને સરકારી એક્ટની સંકલન ૧૩ની પેટા કલમ (૮)ની જગ્યાએ અનુસાર સુરક્ષિત મિલકતોને બચાવવા માટે પ્રાપ્ય થતા લાભ અને ધ્યાન ધોરણમાં આવે છે."

સ્થાયર મિલકતોનું વર્ણન

૧) રહેણાંક મિલકતનો તમામ ભાગ અને કિસ્સો - ફ્લેટ નં. બી-૧૦૨, સેક્ટર આશરે ૭૦૫ ચો.ટી. પાંચમા માળ પર, સહજ સ્પેસીઅલ નામની સ્કીમમાં, રેવન્યુ સર્વે નં. ૫૮૦/૧, ૫૮૦/૨, ૫૮૦/૩, ૫૮૦/૪, ૫૮૦/૫ અને ૫૮૦/૬, ટી પી સ્કીમ નં. ૮૪, મોજે શાહવાડી, તાલુકા સીટી રજી. ડિ. અમદાવાદમાં આવેલ છે કે જેની ચતુ:સીમા નીચે મુજબ છે:

ઉત્તર: ફ્લેટ નં. બી-૫૦૧, દક્ષિણ: સોસાયટી રોડ, પૂર્વ: ફ્લેટ નં. બી-૫૦૨ની ખુલ્લી અગાડી, પશ્ચિમ: સોસાયટીનો બગીચો

૨) રહેણાંક મિલકતનો તમામ ભાગ અને કિસ્સો - મ્યુનિસિપલ સેક્ટ નં. ૧૨૨ વાઇડ સીટી સર્વે નં. ૧૮૦, સેક્ટર આશરે ૨૬૦.૩૦ ચો.ટી. પેક્ટ પશ્ચિમ બાજુએ મહેરાવાડ ગ્રાઉન્ડ ફ્લેટ, પહેલો માળ, બીજો માળ અને અગાડીના આશરે ૨૬૦.૩૦ ચો.ટી.ના છક્ક સાથે, સેક્ટર આશરે ૯૬.૬૨ ખાતે આવેલ, વોર્ડ ખાડિયા-૨, તાલુકા સીટી રજી. ડિ. અમદાવાદ ખાતે આવેલ છે, કે જેની ચતુ:સીમા નીચે મુજબ છે:

ઉત્તર: બાજુનું મકાન, દક્ષિણ: બાજુનું મકાન, પૂર્વ: મુરલિધરનો વહેમો, પશ્ચિમ: મહેરાવાડ

તા: ૧૦-૦૮-૨૦૨૧
 સ્થળ: અમદાવાદ

અધિકૃત અધિકારી
 ઠેક ઓફ ઇન્ડોર

Sadbhav Infrastructure Project Limited
 CIN: L45202GJ2007PLC049808

Regd office: "Sadbhav House", Opp. Law Garden Police Chowki, Ellisbridge, Ahmedabad - 380006
 Phone: 079 - 26463384, Fax: 079 - 26400210, Email: investor@sadbhavinfra.co.in, Web: www.sadbhavinfra.co.in

EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2021
 (INR in Million except as stated otherwise)

| Sr No | Particulars | Standalone | | | | Consolidated | | | |
|-------|--|---------------|---------------|----------------|----------------|---------------|---------------|----------------|----------------|
| | | Quarter ended | | Year Ended | | Quarter ended | | Year Ended | |
| | | June 30, 2021 | June 30, 2020 | March 31, 2021 | March 31, 2021 | June 30, 2021 | June 30, 2020 | March 31, 2021 | March 31, 2021 |
| 1 | Total Income from operations | 326.50 | 488.35 | 603.71 | 1,927.55 | 1,948.04 | 2,522.41 | 4,055.86 | 12,807.88 |
| 2 | Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items) | (202.50) | 91.84 | (264.26) | (143.07) | (789.22) | (924.63) | (860.59) | (2,832.85) |
| 3 | Net Profit / (Loss) for the period before Tax (After Exceptional items) | (824.60) | 91.84 | 166.25 | 287.44 | (1,411.32) | (924.63) | (430.80) | (2,402.34) |
| 4 | Net Profit / (Loss) for the period after Tax (After Exceptional items) | (643.56) | 65.05 | 133.38 | 218.93 | (1,329.77) | (968.25) | (592.56) | (2,782.98) |
| 5 | Total comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] | (643.56) | 65.05 | 132.11 | 217.66 | (1,329.77) | (968.25) | (592.28) | (2,782.70) |
| 6 | Paid up Equity Share Capital (Face value of INR 10 each) | 3,522.25 | 3,522.25 | 3,522.25 | 3,522.25 | 3,522.25 | 3,522.25 | 3,522.25 | 3,522.25 |
| 7 | Other Equity (excluding Revaluation Reserve) | - | - | - | 14,708.52 | - | - | - | (1,652.76) |
| 8 | Earnings Per Share (face value of INR 10/- each) (not annualised) - in INR | | | | | | | | |
| | Basic & Diluted | (1.83) | 0.18 | 0.38 | 0.62 | (3.78) | (2.75) | (1.68) | (7.90) |

Notes:

1 The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results is available on the websites of the Stock Exchanges i.e. www.bseindia.com, www.nseindia.com and on the Company website www.sadbhavinfra.co.in.

For and on behalf of the Board of Directors of
Sadbhav Infrastructure Project Limited
Vasistha C. Patel
Managing Director (DIN: 00048324)

Place : Ahmedabad
 Date : August 12, 2021

૧૦ | **ફાઇનાન્સિયલ એક્સપ્રેસ** | અમદાવાદ, શનિવાર, તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૧

GUJARAT STATE FINANCIAL CORPORATION
 (Established by Gujarat State under State Financial Corporation Act, 1951)
 Block No.10, Udyog Bhavan, Sector-11, GH-4, Gandhinagar - 382 010
 Phone No.: (079) 23256766 Fax (079) 23252204
 Website : http://gsfc.gujarat.gov.in E-mail: sec-cell-gsfc@gujarat.gov.in

Extract of unaudited Financial Results for the quarter ended on 30th June, 2021

| Particulars | Quarter ended | Year ended | Quarter ended |
|--|----------------------------|-------------------------|----------------------------|
| | 30.06.2021 (un-audited) | 31.03.2021 (audited) | 30.06.2020 (un-audited) |
| Total income from Operations (net) | 271.99 | 1,384.77 | 282.97 |
| Net profit/loss from ordinary activities after tax (before extra ordinary items) | (3,139.60) | (12,291.75) | (3,095.88) |
| Net profit/loss from ordinary activities after tax (after extraordinary items) | (3,139.60) | (12,291.75) | (3,095.88) |
| Paidup Equity Share Capital (Face value of Rs.10) | 8,911.40 | 8,911.40 | 8,911.40 |
| Reserves (excluding Revaluation Reserve) as on March 31 | - | (2,65,428.64) | - |
| Earnings Per Share (EPS) (before and after extraordinary items) | | | |
| (a) Basic | **(3.52) | (13.79) | ** (3.47) |
| (b) Diluted | **(3.52) | (13.79) | ** (3.47) |

Note:

** Not annualized.

1. The unaudited financial results for the quarter ended 30th June, 2021 along with Limited Review Report thereon issued by the statutory Auditors have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on August 13, 2021.

2. The above is an extract of the detailed format of the quarterly financial results filed with BSE Limited under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results is available on BSE Ltd website www.bseindia.com as also on Corporation's website https://gsfc.gujarat.gov.in

3. Figures of the previous periods have been reclassified to conform to the presentation adopted in this statement.

4. The Limited Review Report in respect of the said un-audited financial results contains qualified opinion. The qualifications and the response of the management thereon are available as part of the detailed Regulation 33 formats posted on both websites named above.

Place : Gandhinagar For and on behalf of the Board of Directors,
 Date : 13-08-2021 (Rahul Gupta, IAS) Managing Director

The Indian Express.
 For the Indian Intelligent.

The Indian Express
 JOURNALISM OF COURAGE

SHREE RAM PROTEINS LIMITED
 CIN: L1405GJ2008PLC054913

Registered Office: Imperial Heights Tower-B, Second Floor, Office No. B-206,
 150 Ft Ring Road, Opp Big Bazar Rajkot-380005. Phone: +91 2825280634/35
 Fax: +91 7878036500 E-mail: info@shreeramproteins.com Website: www.shreeramproteins.com

Standalone Unaudited Financial Results for the Quarter ended on June 30, 2021
 (Rs. in Lakh except EPS)

| Sl. No. | Particulars | Quarter ended | Quarter ended | Year ended |
|---------|--|---------------|---------------|------------|
| | | 30-06-2021 | 30-06-2020 | 31-03-2021 |
| | | Unaudited | Unaudited | Audited |
| 1. | Total Income From Operations (net) | 3,890.04 | 347.21 | 15,268.07 |
| 2. | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)# | 135.86 | (19.41) | 109.69 |
| 3. | Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)# | 135.86 | (19.41) | 109.69 |
| 4. | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)# | 101.65 | (19.41) | 83.67 |
| 5. | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 101.65 | (19.41) | 84.45 |
| 6. | Equity Share Capital (Face value of Rs. 10 Each) | 2,142.00 | 2,142.00 | 2,142.00 |
| 7. | Reserves (excluding Revaluation Reserve as shown in the audited Balance Sheet of the previous year) | - | - | - |
| 8. | Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) (not annualised for quarter ended) | | | |
| | Basic : (not annualized for the quarter ended) | 0.47 | (0.09) | 0.39 |
| | Diluted: (not annualized for the quarter ended) | 0.47 | (0.09) | 0.39 |

Note: The above results were reviewed by the Audit committee and subsequently taken on record by the Board of Directors of the company at its meeting held on August 13, 2021. The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the NSE Ltd.. The full format of the quarterly Financial Results are available on the NSE Ltd Website at www.nseindia.com and on the website of the Company at www.shreeramproteins.com

For, SHREE RAM PROTEINS LIMITED
 Lalitkumar Chandulal Vasoja
 Managing Director DIN: 02296254

Place: Rajkot
 Date : August 13, 2021

GUJARAT MINERAL DEVELOPMENT CORPORATION LIMITED
 (A Government of Gujarat Enterprise)
 CIN : L14100GJ1963SGC001206

"Khanij Bhavan", 132 Ft. Ring Road, Nr. University Ground,
 Vastrapur, Ahmedabad - 380052.
 E-mail: cosec@gmdcltd.com Web Site: www.gmdcltd.com

(See Regulation 47(1) (b) of the SEBI (LODR) Regulations, 2015)

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2021 (Rs. in Lakh)

| Sr. No. | Particulars | STANDALONE | | | |
|---------|--|--|--|--|---|
| | | 3 Months ended on 30.06.2021 (Unaudited) | 3 Months ended on 31.03.2021 (Audited) | 3 Months ended on 30.06.2020 (Unaudited) | 12 Months ended on 31.03.2021 (Audited) |
| 1 | Total Income from Operations (net) | 49,833.45 | 56,919.90 | 24,010.56 | 134,263.00 |
| 2 | Net Profit/(Loss) for the period (before Tax and Exceptional/Items) | 4,434.63 | 5,067.92 | 1,272.46 | 5,193.37 |
| 3 | Net Profit/(Loss) for the period before tax (after Exceptional/Items) | 4,434.63 | (34,591.57) | 1,272.46 | (34,466.12) |
| 4 | Net Profit/(Loss) for the period after tax (after Exceptional/Items) | 3,751.06 | (18,186.11) | 13,665.15 | (3,708.60) |
| 5 | Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period after tax and Other Comprehensive Income (after tax)] | 8,368.91 | (21,577.41) | 19,133.37 | 463.72 |
| 6 | Equity Share Capital | 6,360.00 | 6,360.00 | 6,360.00 | 6,360.00 |
| 7 | Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet) | | | | 394,040.07 |
| 8 | Earning Per Share (of Rs. 2/- each) (for continuing and discontinued operations) (not annualised): | | | | |
| | 1. Basic: (Rs.) | 1.18 | (5.72) | 4.30 | (1.17) |
| | 2. Diluted (Rs.) | 1.18 | (5.72) | 4.30 | (1.17) |

| Sr. No. | Particulars | CONSOLIDATED | | | |
|---------|--|--|--|--|---|
| | | 3 Months ended on 30.06.2021 (Unaudited) | 3 Months ended on 31.03.2021 (Audited) | 3 Months ended on 30.06.2020 (Unaudited) | 12 Months ended on 31.03.2021 (Audited) |
| 1 | Total Income from Operations (net) | 49,833.45 | 56,919.90 | 24,010.56 | 134,263.00 |
| 2 | Net Profit/(Loss) for the period (before Tax and Exceptional/Items) | 4,396.58 | 4,961.20 | 1,257.30 | 5,041.20 |
| 3 | Net Profit/(Loss) for the period before tax (after Exceptional/Items) | 4,396.58 | (34,698.29) | 1,257.30 | (34,618.29) |
| 4 | Net Profit/(Loss) for the period after tax (after Exceptional/Items) | 3,771.19 | (18,125.61) | 13,610.83 | (3,596.13) |
| 5 | Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period after tax and Other Comprehensive Income (after tax)] | 8,389.04 | (21,515.29) | 19,079.05 | 577.81 |
| 6 | Equity Share Capital | 6,360.00 | 6,360.00 | 6,360.00 | 6,360.00 |
| 7 | Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet) | | | | 397,462.70 |
| 8 | Earning Per Share (of Rs. 2/- each) (for continuing and discontinued operations) (not annualised): | | | | |
| | 1. Basic: (Rs.) | 1.19 | (5.70) | 4.28 | (1.13) |
| | 2. Diluted (Rs.) | 1.19 | (5.70) | 4.28 | (1.13) |

Notes:

The above is an extract of the detailed format of Financial Results for the quarter ended on 30th June 2021 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (